

Master of Physical Education (Sem.-IV) Examination

M.P.E. : 607

Measurement & Evaluation in Physical Education

Time : 2-00 Hours]

July 2021

[Max. Marks : 50]

- સ્વીચ્છા : (૧) વિભાગ-૧માંથી કોઈપણ ત્રણના જવાબ લખો.
 (૨) જમણી બાજુના અંક પ્રશ્નના ગુણ દર્શાવો.

વિભાગ-૧

૧	માપન અને મૂલ્યાંકન એક સિક્કાની બે બાજુ છે. આ વિધાનની સ્પષ્ટતા કરી, શારીરિક શિક્ષણ ૧૪ અને રમતોભાં માપન અને મૂલ્યાંકનની અગત્યતા વર્ણવો.
૨	વિશ્વસનિયતા એટલે શું ? તેના પ્રકારો સમજાવી તેને અસર કરતા પરિબળો જણાવો. ૧૪
૩	હાર્વેટ સ્ટેપ કસોટી સમજાવી તેનાં વિવિધ ફેરફારો જણાવો. ૧૪
૪	ઈન્ડિયાના ગત્યાત્મક યોગ્યતા કસોટી સવિસ્તાર સમજાવો. ૧૪
૫	લાર્સન કસોટી તથા બેરોની સામાન્ય ગત્યાત્મક શક્તિ કસોટી સમજાવો. ૧૪
૬	બીલીય બાસ્કેટ બોલ કસોટી તથા કોર્નિસ હેન્ડબોલ કૌશલ્ય કસોટી વર્ણવો. ૧૪
૭	આયોવા પોશ્યર કસોટી તથા ક્યૂરેટન માપન વિગતે સમજાવો. ૧૪
૮	શરીરમિત માપનોની યાદી કરી, દરેકની વિગતે માહિતી આપો. ૧૪

વિભાગ-૨

યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો (કોઈપણ ચાર) :

- (૧) નીચેનામાંથી કોને ગુણાત્મક ટેસ્ટીંગની જરૂરિયાત હોય છે ?
 (અ) સ્નાયુક્સ બળ (બ) ફૂટબોલમાં રમવાની શક્તિ
 (ક) બાસ્કેટ બોલમાં શૂટિંગ શક્તિ (દ) ઝડપી ઢોડ.
- (૨) ૪×૧૦ મીટર શાટલ રન નીચેનામાંથી ગત્યાત્મક યોગ્યતાનાં ક્યા પાસાંઓનું માપન છે ?
 (અ) ગત્યાત્મક ગુણવત્તા (બ) ઢોડ કૌશલ્ય
 (ક) ચપળતા (દ) ગતિશીલ સમતોલન.
- (૩) નીચેનામાંથી કસોટીના ક્યા બે ધોરણો નજીકનો સંબંધ ધરાવે છે ?
 (અ) નોર્મસ અને પ્રમાણભૂતતા (બ) વિશ્વનિયતા અને પ્રમાણભૂતતા
 (ક) હેતુલક્ષીતા અને પ્રમાણભૂતતા (દ) વિશ્વનિયતા અને હેતુલક્ષીતા.
- (૪) AAHPERD નું પૂર્ણરૂપ ક્યું છે ?
 (અ) અમેરિકન અને ઓસ્ટ્રેલિયન હેલ્થ, ફિઝિકલ એજ્યુકેશન, રિક્િયેશન અને ડાન્સ
 (બ) અમેરિકન એસોસિયેશન ફોર હેલ્થ, ફિઝિકલ એજ્યુકેશન, રિક્િયેશન અને ડાન્સ
 (ક) અમેરિકન ઓલાયન્સ ફોર હેલ્થ, ફિઝિકલ એજ્યુકેશન, રિક્િયેશન અને ડાન્સ
 (દ) ઉપરોક્તમાંથી એકપણ નથિં.
- (૫) હાર્વેટ સ્ટેપ કસોટીમાં છોકરાઓ માટે બેન્ચની બેંચાઈ કેટલી હોય છે ?
 (અ) ૧૫ ઇંચ (બ) ૨૦ ઇંચ (ક) ૨૪ ઇંચ (દ) ૩૦ ઇંચ
- (૬) કોસ વેબર સ્નાયુક્સ કસોટીમાં કુલ કેટલી આઇટેમ છે ?
 (અ) પાંચ (બ) ચાર (ક) ત્રણ (દ) છ
- (૭) મીલર વોલ વોલી કસોટી કઈ રમત માટે છે ?
 (અ) બેડમિન્ટન (બ) ટેનિસ (ક) સોકર (દ) વોલીબોલ.
- (૮) પત્રનું બળ માપવા માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ/સાધન સૌથી વધુ વૈજ્ઞાનિક જણાય છે ?
 (અ) ખડી લાંબીકૂદ (બ) કવોટ્સ અને ડિપ્સ (ક) બરપી (દ) ડાયનેમોમીટર.